



બ્રેમ્પટન ટ્રાન્ઝિટના કસ્ટમર સર્વિસ કાઉન્ટર્સ મોટા ભાગના ટર્મિનલ્સ પર જૂન 22 થી ફરીથી ખોલવામાં આવશે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જૂન 19, 2020) – સીટી ઓફ બ્રેમ્પટનના રિઓર્ગનીંગ અને રિકવરી પ્લાનના ભાગરૂપે, બ્રેમ્પટન ટ્રાન્ઝિટના બ્રેમલી, બ્રેમ્પટન ગેટવે અને ડાઉનટાઉન ટર્મિનલ્સમાંના કસ્ટમર સર્વિસ કાઉન્ટર્સ જૂન 22 થી ફરીથી ખોલવામાં આવશે. ટ્રિનિટી કોમન ટર્મિનલ બિલ્ડિંગ વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવવા માટે જગ્યાની ઉણપ હોવાને લીધે બંધ રહેશે.

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ ટર્મિનલ્સમાં ક્ષમતા સીમિત હોવાને લીધે, નીચેના ટર્મિનલ્સ પર કસ્ટમર સર્વિસ કાઉન્ટર્સ, ગેટવે ઓન ધી ગો અને વોશરૂમ ઉપયોગ માટે ખોલવામાં આવશે.

કસ્ટમર સર્વિસ કાઉન્ટર પર કામકાજના ક્લાકો નીચે મુજબ રહેશે.

બ્રેમલી ટર્મિનલ

- સોમવારથી શુક્રવાર: સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધી
- શનિવાર: સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી
- રવિવાર: સવારે 11 થી સાંજે 6 વાગ્યા સુધી

બ્રેમ્પટન ગેટવે ટર્મિનલ

- સોમવારથી શુક્રવાર: સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધી
- શનિવાર: સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી
- રવિવાર: સવારે 11 થી સાંજે 6 વાગ્યા સુધી

ડાઉનટાઉન ટર્મિનલ

- સોમવારથી શુક્રવાર: સવારે 7 થી સાંજે 7 વાગ્યા સુધી
- શનિવાર: સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી
- રવિવાર: બંધ

આ શહેર સામુદાયિક આરોગ્ય અને સુરક્ષાને બહુ ગંભીર રીતે લે છે, ખાસ કરીને COVID-19 દરમિયાન. કસ્ટમર સર્વિસ કાઉન્ટર્સ ફરીથી ખુલે ત્યારે નીચેના સુરક્ષા ઉપાયો અમલમાં રહેશે.

- વ્યક્તિઓ વચ્ચે બે-મીટરનું શારીરિક અંતર જાળવવાના પગલાઓ અમલમાં રહેશે. ગ્રાહકોને કસ્ટમર સર્વિસ વિન્ડોસ પર બે મીટરનું અંતર રાખવાનું કહેવામાં આવશે, અને ઉપાયનો પુનરોચ્ચાર કરવા ચિલનો મૂકવામાં આવશે.
- ટર્મિનલ્સ પર વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવવાના પગલાઓને સહાયરૂપ થવા અને ગ્રાહકોને માહિતગાર રાખવા કર્મચારીઓ હાજર રહેશે.
- દરેક ટર્મિનલમાં પ્રવેશવા અને બહાર નીકળવા માટે સમર્પિત દરવાજાઓ રહેશે, જ્યાં પણ પરવાનગી મળે.
- કસ્ટમર સર્વિસ કાઉન્ટર્સ અને પિન પેડ્સ અવારનવાર સેનિટાઈઝ કરવામાં આવશે.

આ શહેરમાં વયોવૃદ્ધ વડીલો માટે પહોંચ સુલભ ટ્રાન્ઝિટ પૂરું પાડવું ટોચની અગ્રતા છે, અને COVID-19 નાં પ્રભાવને ધ્યાનમાં લેતા, બંધાં સક્રિય બ્રેમ્પટન ટ્રાન્ઝિટ સીનિયર આઈડી કાર્ડની સમાપ્તિ તારીખ અચોક્કસ સમય સુધી માફ કરવામાં આવી છે.



ક્લાર્ક અને સેન્ટલવૂડ સગવડો જાહેર જનતા માટે બંધ રહેશે.

ઉતારુઓ માટે પુરવઠો ઉપલબ્ધ રહે ત્યાં સુધી માસ્ક્સ મફતમાં આપવામાં આવશે

સીટી ઓફ બ્રેમ્પટનના રિઓર્પનીંગ અને રિકવરી પ્લાનના પહેલા પગલા તરીકે, બ્રેમ્પટન ટ્રાન્ઝિટ પોતાના ઉતારુઓને 100,000 નોન-મેડિકલ માસ્ક્સ મફતમાં વહેંચશે, પુરવઠો ઉપલબ્ધ રહે ત્યાં સુધી. નોન-મેડિકલ માસ્ક્સ બ્રેમ્પટન ટ્રાન્ઝિટના બ્રેમલી, બ્રેમ્પટન ગેટવે અને ડાઉનટાઉન ટર્મિનલ્સ પર જૂન 22 નાં અઠવાડિયાના અંત સુધી વિતરિત કરવામાં આવશે.

બસમાં ભાડું ચૂકવણી, આગળના દરવાજેથી પ્રવેશ અને નોન-મેડિકલ માસ્ક્સ – જુલાઈ 2 થી અમલમાં આવશે

આ શહેર ઉતારુઓને યાદ અપાવે છે કે ગુરુવાર, જુલાઈ 2 થી, બસમાં ભાડું ચૂકવણી અને આગળના દરવાજેથી પ્રવેશ ફરીથી શરૂ કરવામાં આવશે. પીલ પબ્લિક હેલ્થ અને ગવર્નમેન્ટ ઓફ ઓન્ટેરિયોની પબ્લિક ટ્રાન્ઝિટમાં માસ્ક્સ પહેરવાની કડક ભલામણને અનુસરતા, બ્રેમ્પટન ટ્રાન્ઝિટમાં પ્રવાસીઓ અને ઓપરેટરો માટે બસોમાં અને ટર્મિનલ્સ પર જુલાઈ 2 થી નોન-મેડિકલ માસ્ક્સ પહેરવા અનિવાર્ય બનશે.

માસ્ક્સ પહેરવા અનિવાર્ય છે ત્યારે, જુવાન બાળકો કે તેઓને માસ્ક પહેરતા રોકે તેવી અન્ય તબીબી સ્થિતિઓ ધરાવતા બાળકોએ માસ્ક પહેરવા જરૂરી રહેશે નહીં.

ઉતારુઓને સંપર્કરહિત ચૂકવણી સ્વરૂપે પોતાનું ભાડું ચૂકવવા પોતાના PRESTO કાર્ડનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. બ્રેમ્પટન ટ્રાન્ઝિટ હજુ પણ રોકડ ચૂકવણીનો ઉપયોગ કરતા ઉતારુઓને કસ્ટમર સર્વિસ કાઉન્ટર પરથી PRESTO કાર્ડ મેળવી લેવા પ્રોત્સાહિત કરે છે. જૂન 22 થી શરૂ કરીને અમે સીમિત સમય સુધી, ગ્રાહક દીઠ એક કાર્ડ માટે \$6 ની PRESTO કાર્ડ ફી માફ કરીશું.

COVID-19 સુરક્ષા ઉપાયો

આ શહેર ઉતારુઓને ટર્મિનલ્સ પર, અને બસ સ્ટોપ્સ પર, માસ્ક પહેર્યો હોય તો પણ, એકબીજાથી ઓછામાં ઓછું બે મીટર (છ ફુટ) દૂર રહીને શારીરિક અંતર સંબંધિત ઉપાયો જાળવવા વિનંતી કરે છે. ઉતારુઓને પ્રવાસ કરતી વખતે, પોતાના અંગત ડિસઈન્ફેક્ટન્ટ (ચેપનાશક પદાર્થ), જેમ કે હેન્ડ સેનેટાઈઝર કે વાઈપ્સ સાથે રાખવાનું, પોતાના હાથ વારંવાર ધોવાનું અને પોતાની કોણીમાં ખાંસી કરવાનું કે છીંકવાનું પણ યાદ અપાવવામાં આવે છે.

વધારે સારી સફાઈ અને સ્વચ્છતા (સેનિટાઈઝિંગ) સમયપત્રક અમલમાં રહે છે. બ્રેમ્પટન ટ્રાન્ઝિટનું લક્ષ્ય તમામ સખત સપાટીઓ, ઓપરેટર કમ્પાર્ટમેન્ટ્સ અને બેઠકોને દર 48 કલાકે ચેપરહિત કરવાનું છે. મોટા ભાગની બસોને હાલમાં દર 24 કલાકે સેનિટાઈઝ કરવામાં આવે છે. સખત સપાટીઓ ધરાવતી સગવડો અને ટર્મિનલ્સને રોજંદા ધોરણે સાફ અને સેનિટાઈઝ કરવામાં આવે છે.

પીલ પબ્લિક હેલ્થના માર્ગદર્શન પ્રમાણે, સીટી ઓફ બ્રેમ્પટન દરેક વ્યક્તિને નોન-મેડિકલ માસ્ક પહેરવા પ્રોત્સાહિત કરે છે, ખાસ કરીને એવા સ્થળોએ જ્યાં વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવવું પડકારભર્યું હોઈ શકે. સીટી ઓફ બ્રેમ્પટન જોખમો પર દેખરેખ ચાલુ રાખવા પીલ પબ્લિક હેલ્થ અને બ્રેમ્પટન ઈમરજન્સી મેનેજમેન્ટ ઓફિસમાં પોતાના ભાગીદારો સાથે ઘનિષ્ઠપણે કામ કરી રહ્યું છે. અદ્યતન માહિતી નિયમિત મેળવવા વેબસાઈટ www.brampton.ca/covid19 અને www.bramptontransit.com જોતા રહો અથવા સર્વિસ અપડેટ્સ માટે Twitter પર @bramptontransit ને અનુસરો. કોઈ પ્રશ્નો સીધા બ્રેમ્પટન ટ્રાન્ઝિટના સંપર્ક કેન્દ્રને 905.874.2999 નંબર પર પૂછી શકાય છે.



BRAMPTON

Service and Information Update

मिडिया संपर्क :

मोनिका दुग्गल (Monika Duggal)

कोऑर्डिनेटर, मिडिया अन्ड कम्युनिटी एंगेजमेन्ट

व्यूडाल्मिक संवाद

सीटी ओफ् ब्राम्पटन

905-874-3426 | Monika.Duggal@brampton.ca